

#### PUBLIC NOTICE

The branch of IIFL Finance Ltd., locate at 1" Floor, Shop 18, 19, 20, 21, 2 Mahakali Complex, Busstand Mai Road, Chotila, Surnedranagar - 36352 Gujarat will be shifted to belo mentioned address with effect from

mentioned address with effect fro 12" June 2021 New Address: III-F Finance Ltd., Grour Floor, Balaiji Complex, Busstand Roa Chotila, Surnedranagar - 36352 Gujarat. Contact: 75750 78978 76230 18132.

### <u>જાહેર નોટિસ</u>

શાઇઆઇએફએલ ફાઇનાન્સ લિમિટેડની ચોટીઃ ાખાનું,દુકાન નં.18, 19, 20, 21, 22, મહાકાર મપ્લેક્સ, પહેલો માળ, બસસ્ટેન્ડ મેઈન ગે

Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Fin Security Interest Act, 2002 (The Act) ancial Assets and Enforcement of

S.	Name of Borrower(s)	Particulars of Mortgaged	Date Of	Outstanding
NO.				Amount
NO	(A)	property/ (ies) (B)	NPA(C)	
				( Rs.) (D)
1	LOAN ACCOUNT NO.	PLOT NO. 21, CHINA ROW HOUSE, B/S		
	HLLASUR00293880	SAINATH BUNGLOWS, NEAR		(Rupees One Cror
	1. AMIT JITENDRA GANDHI	SMC QUARTERS, PANAS ALTHAN		Forty Three Lakh
	PROPRIETOR	ROAD, ALTHAN, SURAT-395007		Ninety Four
	GURUKRUPA IMPEX (G IMPEX)	GUJARAT		Thousand Two
	2. JITENDRA GANDHI			Hundred Seventy
	3. INDIRA JITENDRA GANDHI			and Paisa Forty
	4. MAYURI AMIT GANDHI			Six Only)as on
				31.03.2021
2	LOAN ACCOUNT NO.	SUB PLOT NO. 26/B. SHREE RAM	31.03.2021	Rs. 2.35.94.608.60
	HLLARA.100329759	PARNAKUTI SOCIETY, STREET NO. 2, NANA		(Rupees Two Cror
	1.PATEL FOUNDRY	MAVAMAINROAD, RAJKOT-360001 GUJARAT		Thirty Five Lakh
	(TROUGH ITS PARTNERS)	IIIAVAIIIAIITITOAD, TOATICO TOCCOTTOCOTATA		Ninety Four
	2 DHIRAJI AL JINABHAI PATEL			Thousand Six
	ALIAS DHIRAJI AL JINABHAI			Hundred Eight and
	BHOOT			Paisa Sixty Only)
	3 BHUT URVISH DHEERUBHAI			as on 31.03.2021
				as on 31.03.2021
	ALIAS URVISH DHIRAJLAL			
	BHOOT			
	4.BHUT MUKTABEN D.			
	ALIAS MUKTABEN		1	
	DHIRAJLAL BHOOT			

towards the Company by making the payment of the entire outstanding dues incleated in Column D above of deat interest, costs, and charges within 60 days from the deate of publication of this notice, falling which core entitled to take possession of the Mortgaged Property mentioned in Column B above and shall also take such o is available to the Company in law.

Please note that in terms of provisions of sub-Section (8) of Section 13 of the SARFAESI Act. 14 horowork and any about 10 outstanding dues beginner with all costs, charges and expenses incurred by the Secured Cereditor only publication of the notice for sale of the secured asset(s) by public auction, by inviting qualitations, trader from public them to the contract of the secured asset within affected leg in the secured asset within affected did not the contract of the contrac

Place: SURAT/RAJKOT

Corporate Centre, Stressed Assets Resolution Group, 2<sup>nd</sup> floor, Tower "4", The Arcade Building, World Trade Centre, Cuffe Parade, Mumbai - 400 005.

## SALE OF FINANCIAL ASSETS TO BANKS/ ARCs/NBFCs/Fis THROUGH e-AUCTION

State Bank of India invites bids from the Banks/ARCs/ NBFCs/Fls through e-Auction for sale of financial assets Banks/ARCs/NBFCs/Fls interested in bidding for buying such financial assets, to be showcased by the Bank from time to time can participate in the bidding process after executing a non-disclosure agreement with the Bank, <u>if not alread</u>y executed. For execution of non-disclosure agreement with the Bank & other queries, if any, such interested Banks/ARCs/ NBFCs/Fls can contact on e-mail id-dgm.sr@sbi.co.in

State Bank of India invites Expression of Interest from Banks ARCs/NBFCs/FIs for the proposed sale of its Non Performing ANCS/INDECS/FIS for the proposed sale or its Non Performing Assets (NPAs) comprising (01) financial asset with Total outstanding of ₹18.57 Crore. Interested prospective bidders are requested to intimate their willingness to participate in the e-Auction by way of an "Expression of Interest". Kindly visit Bank's Website at <a href="https://bank.sbi</a> Click on link SBI In the news > Auction Notice > ARC AND DRT for further details.

Issued by

Place: Mumbai Date: 13-05-2021

Deputy General Ma



### T.No.e-01/CE(C&C)/SE(C&C)/DE(C)/A3/TSGENCO/2021-22

5-VI Stage — Purchase, Collection & Removal of Coal Mill rejects available teing operated during FY 2021-22 at KTPS-VI Stage, for a contract period of e (12) months from the date of issue of sale order on "As is where is basis ection Start & End Date: 05.05.2021 at 10:30 Hrs & 25.05.2021 at 17:00 Hrs

### T.No.e-03/CEG/SEG-I/E4A3/KTPP(O&M)/IAR Insurance/2021-22

KTPP – Providing Insurance Coverage to the plant assets of KTPP SI (1500 MW) & Slage-II (17600MW) Units under Industrial All Risk Policy arranging insurance coverage for Standalone Public Liability and Terrorisk KTPP for a period of one year from 01.06.2021 @ 00:00 Hrs to 31.05.202 24:00 Hrs. Sum insurat-5 e921.265.5714. Scheduled Open & Closing D 11.05.2021 at 17:00 Hrs & 21.05.2021 at 10:30 Hrs.

#### T.No.e-04/CEG/SEG-I/E2A1/KTPS-V&VI/IAR Insurance/2021-22

TPS-V8U Stage – Providing of Insurance Coverage to the plant assets of (2x25 MV) Uni-IX, and (1x500 MW) Uni-IX of KTPS-V8U Stages under "Industrial Assets of the plant assets of (2x25 MV) Uni-IX, and (1x500 MW) Uni-IX of KTPS-V8U Stages under "Industrial Asset Policy" and arrangin insurance overage of Standardore Public Liability enterorism for entire plant of KTPS-V8U Stages for a period of one year fror 10s (2x21 MV) of Uni-IX of IX of IX

For further Details: " www.tsgenco.co.in & https://to

#### USHA MARTIN LIMITED

Email: investor@ushamartin.co.in Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, 20<sup>th</sup> May, 2021 to interalia, consider and approve the Audited Financial Results of the Company for the quarter and year ended 31st March, 2021.

For Usha Martin Limite Shampa Ghosh Ray 12.05.2021 Company Secretary

Name of the Borrower(s). /Guarantor (s)	Demand Notice Date & Amount	Description of secured asset (immovable property)
Mr. Bhavin Govindial Mehta, 380 Buildoon Pvt Ltd, Mr. Chandreshkumar Gokardas Vasoya, Mr. Dipak Modial Thakker, Mr. Parimal Hasmukhlal Gandhi, Mrs. Nidrh Parimal Gandhi, Mrs. Dipikaben Dipakbhai Thakkar, Mrs. Harshaben Vasoya, Mrs. Trupti Jaypraksah Vyas (Prospect No. 383971 and 580356)	10-May-2021 For Prospect No. 938971 Rs. 34,46,365.00/-(Rupees Thirty Four Lakih Forty Six Thousand Three Hundred Sixty Five Only) and Prospect no. 550356 Rs. 1,91,53,843.00/- (Rupees One Crore Ninety One Lakih Filly Three Thousand Eight Hundred Forty Three Only)	
Mr. Prashant Umedshinh Jariya, Mrs. Dolly Bharatkumar Vaghtela, Mrs. Jayotsnaben Bahadur Jariya, Mr. Umed Karshanbhai Jariya (Prospect No. 709266)	10-May-2021 Rs. 19,85,990.00/- (Rupees Nineteen Lakh Eighty Five Thousand Nine Hundred Ninety Only)	All that piece and parcel of the property being: Unit No. 14, Admeasuring 52.39 Sq.Mtrs., Radha Nagar, R.S. No. 411P, Plot No. 45 To 50 & 53 To 56,City Survey Ward No. 6, City Survey No 2689 Paiki, Opp. Pragtesthwar Mahad, Rajkot, Gujarat

Sd/- Authorised Officer, For IIFL Home Fin



## ORIENT ABRASIVES LIMITED

Regd. Office: GIDC Industrial Area, Porbandar - 360577 (Gujarat).
Tel. No.: + 91-286-2221788 Fax: + 91-286-2222719
Website: www.orientabrasives.com,
Investors Relations E-mail ID: investor@Oalmail.co.in
CIN No.: L24299GJ1971PLC093248

Extract of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2021

Rs.	in	Lacs

						(RS. III Lacs)
			Quarter Ended		Year E	inded
R. 10.	PARTICULARS	March 31, 2021	December 31, 2020	March 31, 2020	March 31, 2021	March 31, 2020
		Audited	Unaudited	Audited	Audited	Audited
1.	Total Income from Operations (Net)	8,546.48	8,913.72	9,072.70	30,414.52	34,784.84
2.	Net Profit for the period / year before tax & exceptional items	525.70	497.01	635.40	1,596.47	2,760.08
3.	Net Profit for the period / year before tax	525.70	497.01	495.67	1,596.47	2,620.35
4.	Net Profit / (Loss) from ordinary activities after tax	258.41	430.65	435.41	1,136.99	2,055.91
5.	Total Comprehensive Income / (Loss) after tax	285.65	424.80	363.18	1,146.68	1,991.99
6.	Equity Share Capital (face value Re. 1/- per share)					
	(Including Shares Forfeited Rs. 0.13 Lacs)	1,196.52	1,196.52	1,196.52	1,196.52	1,196.52
7.	Reserves (excluding Revaluation Reserves as shown in the	-	-			-
	Balance Sheet of previous year)					
8.	Earnings / Loss Per Share (EPS) (of Rs. 1/- each not annualised)					
	Basic	0.22	0.36	0.36	0.95	1.72
	Diluted	0.22	0.36	0.36	0.95	1.72
IOT	EC.					

The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter /Year ended on March 31, 2021 filled with the Slock Exchange Negulations and Slock Exchange Negulations and Slock Exchange Negulations and Slock Exchange Nebulations (2015). The full format of the Audited Financial Results for the Quarter / Near ended on March 31, 2021 six excluded on the Slock Exchange Nebulations (2015). The full format of the Audited Financial Results for the Quarter / Near ended on March 31, 2021 six excluded on the Slock Exchange Nebulation (2015). The full format of the Audited Financial Results for the Quarter / Near ended on March 31, 2021 in accordance with the requirements of Regulation (2016). The Audit Committee and approved by the Board of Directors of Orient Abrasives Limited ("the Company") at their respective meetings held on 11" May, 2021, in accordance with the requirements of Regulation 33 of the SEBI Usating (Diligations & Disclosure Requirements) Regulations, 2015, as amended. The Statutory Auditor have issued an unqualified Audit opinion on these results.

The Board of Directors has recommended a Dividend of Rev. 0.15 per Equity Share of Rev. 1/- each (i.e. 15%) for the year ended March 31, 2021 subject to the approval of shareholders in ensuing Annual General Meeting.

For Orient Abrasives Limite Sd/-Manubhai Ratho Whole Time Director & CEO (Din: 07618837)

Date : 11<sup>th</sup> May, 2021

SHRIRAM

## SHRIRAM TRANSPORT FINANCE COMPANY LTD

Corporate Identity Number (CIN): L65191TN1979PLC007874 Registered Office: Sri Towers, Plot No. 14A, South Phase, Industrial Estate, Gui Chernal - 600 002, Tamin Nadu, India. Tal No. 91-44 - 4852.4666 Fax: 91 - 44 - 4852.5666. Website: www.816i.m. Email di-ciplicalins@8tfc.in

Weblie: www.stfc. Final id-legislange and superior and su

to IEPF Authority.

Tor any queries on the above matter, shareholders are requested to contact the Dentyl Nodel Officer Mrs. Shalls Menon-Telephone No. 022-40959596 or Mrf. Dhypandev Choudhary, Mob. 1900437323. (Fizx No.022-40959597) amailtiepidalma@steft. or Company's Registrar and Stare Transfer Agent, Mrs. Interplated Registry Management Services Private Ltd. Mrs. Authors NMrs. Lima helbaseaut NH Ltd. NSTARTER TRANSFER STREAM COMPANY LTD. (Fig. 1974) and Street. North Usman Road, T. Nagar, Chennai - 600 017, Telephone No. 91-44-28140801 to 28140803 Fax: 91-44-28142479; email: amusha@integratedindia.

Place : Chennai Date : May 12, 2021

FORM G
INVITATION FOR EXPRESSION OF INTEREST
gulation 36A(1) of the Insolvency and Bankruptcy I rsoivency and Bankruptcy Board of India or Corporate Persons) Regulations, 2016 ant Particulars

Mrs. Himadri Foods Limited CA Ramchandra Dallaram Choudhan Reo, No. IBBI/IPA-001/IP-P00157/20 CA Ramchandra Dallaram Choud in Proceedings of the Nover, Near Lakhudi Circle, Navrangpura, Ahmedabad-380014. rdc\_rca@yahoo.com

Address: As mentioned in Sr. No. 20 3. Date of publication of Form G





Insight Out

**Business Standard** newspaper delivering safely to homes and offices

For details, SMS reachbs to 57575 or email order@bsmail.in

f bsindia bsindia

business-standard.com

PTL Enterprises Ltd. CIN: L25111k

FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2021 QUARTER ENDED YEAR ENDED PARTICULARS 31.03.2021 | 31.03.2020 | 31.03.2021 | 31.03.2020 (AUDITED) Net profit for the period (before tax & exceptional items) Net profit for the period before tax (after exceptional items) Net profit for the period after tax (after exceptional items) Total comprehensive income for the period comprising profit for the period (after tax) and other comprehensive income (after tax) Padi-up equity share capital equity shares of ₹ 2 each) Padi-up equity share capital expensives Examings per share (of ₹ 2 each) (not annualised) Basic (₹) Net profit for the period (before tax & exceptional items) 1,462.31 5,617.16 5.800.55 1,256.79 904.05 1,462.31 1,128.90 8,552.80 5,800.55 4,393.57 7,004.46

The above is an extract of the detailed format of quarter and year ended March 31, 2021 financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI Listing Obligations & Discissure Requirements) Regulations, 2015. The full format of the quarter and year ended March 1, 2021 financial results are evaleate on the softice exchange velocities, Palations Stock Exchange velocities, Palations Stock Exchange velocities, Palations Stock Exchange velocities, Palations Stock Exchange velocities (www.plenterprise.com).

Place: London Date: May 12, 2021

ONKAR KANWAR

### PALASH SECURITIES LIMITED

Registered Office: P.O. Hargaon, District Sitapur, Ultar Pradesh - 261 1
Phone (05862) 256220, Fax (05862) 256225, CIN: U15122UP2015PLC06 EXTRACT OF THE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31" MARCH 2021

(₹ in lakhs Standalone Consolidated

Quarter Year Quarter Year (

lo.		Quarter	rear	Quarter	Quarter	rear	Quarter
	Particulars						ended
140.		31.03.2021	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2021	31.03.2020
		(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from operations	2.03	297.83	1.57	1,832.16	5,855.95	1,310.76
2	Net Profit / (Loss) for the period						
	(before tax, Exceptional and / or						
	Extraordinary items)	(0.65)	287.70	(1.43)	(899.86)	(1,248.28)	(164.39)
	tax (after Exceptional and /						
	or Extraordinary items)	(0.65)	287.70	(1.43)	(899.86)	(1,248.28)	(164.39)
4	Net Profit / (Loss) for the period after						
	tax (after Exceptional and /						
	or Extraordinary items)	(0.65)	287.72	(1.43)	(905.84)	(1,282.91)	(169.67)
5	Total Comprehensive Income for the						
	period [Comprising Profit for the						
	period (after tax) and Other						
	Comprehensive Income (after tax)]	(7.80)	358.60	(34.02)	542.56	11,588.97	(6,681.27)
6	Equity Share Capital	1,000.31	1,000.31	1,000.31	1,000.31	1,000.31	1,000.31
7	Other Equity		1,303.68			26,792.63	
8	Earning per share (of ₹10/- each) (in ₹):						
	Basic & Diluted	- *	2.88	(0.02) *	(9.06) *	(12.83)	(1.69) *
	1 2 3 4 5	No.  1 Total Income from operations 2 Net Profit / (Loss) for the period (lefere tax, Exceptional and / or Extraordinary items) 3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) 4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items) 5 Total Comprehensive income for the period (after tax) and Other Comprehensive income (after tax) 6 Equity Share a Gapital 7 Other Equity 8 Total Comprehensive income (after tax) 6 Equity Share Equits 7 Other Equity 8 Earning per share (aft 10-eact) (in ₹):	Sr. No. Particulars and graded 310,32021  1 Total Income from operations 2.03  2 Net Profit (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary Items) (0.85)  3 Net Profit (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items) (0.85)  4 Net Profit (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary Items) (0.85)  5 Net Profit (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary Items) (0.85)  Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax) (7.80)  Equity Share Explait 1,000.31  Other Equity  Equity Share Explait 1,000.31	No.   Particulars   anobed   ended   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   310.3.2021   327.3.3   310.3.2021   310.3.2021   327.3.3   310.3.2021	No.   Particulars   another   anot	Particulars   Annual Company   Particulars   Annual Company   Particulars   Annual Company   Particulars   Annual Company   Annual Company   Particulars   Annual Company   Particulars   Annual Company   Particulars   Particu	Particulars   Particulars

Place : Kolkata Date : 12" May, 2021

00

Notes:

The above is an extract of the detailed format of Quarterly and Yearly Financial Results fleet with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are enabled on the Stock Exchange websites (www.beindia.com and www.rseindia.com) and onthe Company's website "www.bris-sugar.com".

There is no extend ordinary literature beatone periods.

For and on behalf of Board of Directors PALASH SECURITIES LIMITED Chand Bihari Patodia Managing Director DIN - 0138923


••••

## અખાત્રીજના પવનના આધારે વરસાદના એંધાણ જોવાશે

વાચવ્યમાંથી અગ્રિ દિશા તરફ પવન <del>ક</del>ૂંકાય તો સારો વરસાદ

■ દર્શન ઠાકર

બગસરા, તા.૧૨: હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે માટે મહત્ત્વના એવા અખાત્રીજના મહત્વના અવા અખાત્રાજના વહેલી સવારના પવનના અશસાર જોવાશે અને વરસાદ અંગેના સંકેત પવનના રૂખ ઉપરથી જાણવા મળશે. આ વર્ષે હોળીની જાળ અને ચેંગી દનેયા બંને દારા મધ્યમ ચોમાસાનો અણસાર આપવામાં આવ્યા છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર તારીખ ૧૪ भे शुक्रवारना वहेली सवारना



ત્રણથી છ વાગ્યાના પવન પરથી અભ્યાસુઓ આગામી ચોમાસા વિશે અનુમાન કરતા ચીમાં ત્યા અનુતાન ડેન્ડા હોય છે. અખાત્રીજનો પવન વાયવ્ય દિશામાંથી ફૂંકાય અને અગ્નિ દિશા તરફ જાય તો વરસાદ સારો પડે છે પરંતુ જો પવન અગ્નિથી વાયવ્ય તરફ જાય તો દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે અને પશ્ચિમથી પૂર્વ તરફ જાય તો પણ ચોતરફ વનરાજી ખીલી ઉઠવાના એંધાણ હોય છે. તો આખાત્રીજના પવનનો અભ્યાસ કરવા સર્વ ખેડૂતો તથા જાણકારોને ... કરવા સર્વ ત્રડૂતા તથા જાણકારોને અનુરોધ કરાયો છે.

## કૃષિ મંત્રી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલતો રાજકીય ખેલ ઘુણાસ્પદ

માર્કેટિંગ ચાર્ડના ચેરમેન જાડેજાએ તપાસની માગણી કરી

જામખંભાળિયા, તા.૧૨: સંવર્ષના તા.૧૨. દેવભૂમિ દ્વારકા જિલ્લા અગ્રણી અને ખંભાળીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખે આર.સી.ફળદુ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં થયેલ નિવેદનો સામે ઉગ્ર પ્રતિક્રિયા

ાનવદના સામ ઉત્ર પ્રાતાકર્યા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન ભાજપ સરકારના કૃષ્ મંત્રી આર. સી. કળદુજીને ટાગેટ બનાવીને સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી ચોક્કસ તત્ત્વો દ્વારા જે ગંદો રાજકીય ખેલ ખેલવામાં આવી રહ્યો છે તે ખેલવામાં આવી રહ્યો છે તે અત્યંત ઘૃશાસ્પદ છે, વખોડવા લાયક છે અને આ પ્રકારના મેસેજ વાયરલ કરીને કેબિનેટ મંત્રી જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાની ક્રેશિશ કરનારાં તત્ત્વો સામે પોલીસના સાયબર સેલ ઢારા તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે.

મારી માગણી છે. માત્ર જામનગર જિલ્લા જ નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ રાજકારણીઓ ભાજપના સિનિયર નેતા અને કૃષિ મંત્રી આર. સી. ફળદુજીની કાર્યપદ્ધતિથી સારી રીતે વાકેક છે. દરેક આક્ષેપ પાયા વગરના કરવામાં આવ્યા હોવાથી હું ભાજપના એક જવાબદાર આગેવાન તરીકે એવી પણ માંગણી કરું છું કે કેબિનેટ મંત્રીની છબી બગાડવાની કોશિશ મત્રાના છેખા બેગાંડવાના કાશેશ કરનાર સોશિયલ મીડિયા પર પ્રવૃત્તિ તમામ લોકો સામે પોલીસના સાયબર સેલ દ્વારા તપાસ થવી જોઈએ અને આવા લોકોને પાઠ ભણાવવો જોઈએ.

આ સમગ્ર મામલે અને ખાસ આ સમગ્ર મામલ અને બાસ કરીને ભાજપના પ્રતિષ્ઠિત કેબિનેટ મંત્રી પર કાદવ ઉછાળવાની કોશિશ કરના તત્ત્વો સામે પોલીસ તપાસની માંગણી

# વિસાવદરની મુખ્ય બજારોમાં ટ્રાફિક ઘટાડવા કલેક્ટરને રજૂઆત

વિસાવદર તાલુકો ૮૪ ગામો અને ૨૦ જેટલા નેશોનો બનેલ છે. ગ્રામ્ય પ્રજાને ખરીદી માટે અને જીવન જરૂરિયાત ચીજ-વસ્તુ લેવા વિસાવદર આવવું પડતું હોય છે. પણ તંત્રનું કોઈ પડેલું હાય છે. પૈકા તિ તેવું કોઇ આયોજન ના હોવાથી વિસાવદરની મુખ્ય બજારોમાં મેળો ભરાયો હોય તેવું ટ્રાફિક થાય છે જેથી વિસાવદર ટીમ ગબ્બરના સ્થાપક ધર્મેશ કાનાણી તથા ટીમ ગબ્બરના સદસ્ય અને વકીલ નયનભાઈ જોષી અને તેમની ટીમ દ્વારા કલેક્ટ ને રજુઆત કરાઈ છે કે વિસાવદરમાં સવારના ૦૮ થી બપોરના ૦૨ વાગ્યા સુધી શાકભાજી અને કરીયાણા અને સાકભાજ અને કરાવાલા અને અન્ય દુકાનો ખૂલી રહેતી હોય અને વિસાવદરની મેઈન બઝારમાં કરીયાણાની દુકાનો પાસે જ આરોગ્ય કેન્દ્ર, મેડિકલ



વિસાવદરની મખ્ય બજારોમાં વધેલો ટાફ્કિ. (કૌશિકપરી ગોસ્વામી)

સ્ટોરો, નગર પાલિકા, અને શાક માર્કેટની દુકાનો તેમજ અન્ય દુકાનો એક જ જગ્યાએ હોવાથી સવારથી જ લોકોની ટાફિક જામ થાય છે અને લોકોને અગવડતા ઉભી થાય છે. અને વધુમાં કોવીડ-૧૯ ના લક્ષણો ધરાવતા લોકો પણ આ જ જગ્યાએ ખરીદી માટે આવતા હોય જેથી આ

અંગે તાત્કાલિક યોગ્ય કરી કોવીડ-૧૯ ના કેસોમાં ઘટાડો થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને વધુમાં ટીમ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે શાક માર્કેટ અને છૂટક શાકની લારીઓ ખુલ્લી જગ્યા કે મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવે તો લોકોની ભીડ અટકાવી

# લખતરના અણિયાળી ગામમાં લોકોના પાણી માટે વલખા

કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી પૂરતું ન મળતા લોકોમાં રોષ

લખતર, તા.૧૨: લખતર તાલુકાનાં અશિયાળી ગામનાં લોકોને ભરઉનાળે પીવાના તેમજ વાપરવાના પાણી માટે વલખા મારતા હોય તેવો ઘાટ સર્જાયો હોવાનું જોવા મળે છે. ત્યારે આવી જ પરિસ્થિતિ દર ત્યાર આવા જ પાસસ્યાત દર ઉનાળાની સીઝનમાં થતી હોવાના કારણે મહિલાઓ અને ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડતી હોવાનું જોવા મળે છે. તો

મોરબી.

તા.૧૨: મોરબી તારુવા, તા. ૧૨. નારુવા સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીને કારણે સુવિધામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેમાં

ત્રાજથી સિવિલ કમ્પાઉન્ડમાં લિક્વિડ આજવા ભાગલ કમ્પાડન્ડના લાક્વડ ઓક્સિજન વગર હવામાંથી ઓક્સિજન બનાવતો આધુનિક પ્લાન્ટ કાર્યરત થયો છે.જે દર મિનિટે

૧૦૦ લીટર મેડિકલ ઓક્સિજન

જનરેટ કરશે. કોરોના મહામારીમાં મોરબી

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની



પાણી માટે તડકામાં શેકાતી મહિલાઓ. (ધવલ આચાર્ય)

અંગે દર વર્ષે ગ્રામજનો

(સુરેશ ગોસ્વામી) ઓક્સિજનના અભાવે કેટલાય

દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું પણ જગજાહેર છે ત્યારે આજથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હવામાંથી

સાવલ હાસ્પેટલ ખાત હવામાથી એક્સિજન ભનાવતો આધુનિક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સતાવાર સૂત્રોના જશાવ્યા મુજબ હવામાંથી એક્સિજન બનાવતા આ પ્લાન્ટમાં લિક્વિડ એક્સિજનની જરૂરત રહેતી નથી આ પ્લાન્ટમાં દર મિનિટે ૧૦૦ લીટ્સ એક્સિજન હિંમન જાય છે

લીટર ઓક્સિજન ઉત્પન થાય છે

મોરબી સિવિલમાં ઓક્સિજન

ઉત્પન્ન કરતો પ્લાન્ટ શ3

કાયમી ઉકેલ

પિતાની અર્થીને કાંધ આપતી બે પુત્રી

લખતર તાલુકામથકથી લગભગ સાતેક કી.મી. દૂર અણિયાળી ગામ આવેલું છે. આ ગામમાં ભારઉનાળો ચામજનોમાં પાણીના પોકાર સાંભળવા મળે છે. મળતી વિગત અનુસાર છ. મળતા વિગત અનુસાર તાલુકાનાં અણિયાળી ગામને પાણી પુરવઠાની લાઈનમાંથી

સંપમાં પાણી મળી રહે છે. ત્યારે છેલ્લા દસેક દિવસથી ગામનાં સંપમા પૂરતું પાણી આવતું જ નથી. કાળઝાળ ગરમીમાં પીવાનું જ પાણી પૂરતું ન મળી રહેતું હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો આ અંગે

અમારે દરવર્ષે ઉનાળામાં પાણી અમાર દરવેષ ઉત્તાળામાં પણા પૂરતું ન મળી રહેતું હોવાથી મુશ્કેલી ભોગવવી પડે છે. છેલ્લા બે વર્ષથી અમે દર વર્ષે રજૂઆતો કરીએ છીએ તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે પાણીની લાઈન એક ખેતરમાં ખુલ્લી છે. ત્યાં થોડું થોડું ખેતરમા ખુલ્લી છે. ત્યાં થોડુ થોડુ પાશી આવે છે. ત્યાં અમારે આ ધોમધખતા તડકામાં પાણી ભરવા જવું પડે છે. આ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

# TATA TATA POWER The Tata Power Company Limited

						₹ crore
Sr.			Quarter ended		Year er	
No.		31-Mar-21	31-Dec-20	31-Mar-20	31-Mar-21	31-Mar-20
		Audited	(Unaudited)	Audited	Audited	Audited
		(Refer Note 4)		(Refer Note 4)		
a.	Total Income from operations	10,127.39	7,597.91	6,620.80	32,468.10	29,136.37
b.	Profit / (Loss) before Exceptional items and tax	462.65	445.34	549.60	2,096.02	2,142.0
C.	Profit / (Loss) before Tax	462.65	336.05	869.73	1,986.73	2,368.1
d.	Profit / (Loss) for the period/year	481.21	318.41	474.70	1,438.65	1,316.4
e.	Total Comprehensive Income	555.38	250.61	1,121.37	1,058.99	2,152.6
f.	Paid-up Equity Share Capital					
	(Face Value: ₹1/- per share)	319.56	319.56	270.50	319.56	270.5
g.	Total Reserves				20,502.70	17,795.5
h.	Earnings Per Equity Share (of ₹ 1/- each)					
	(not annualised)					
	Basic and Diluted: (In ₹)					
	(i) From Continuing Operations before net					
	movement in regulatory deferral balances	1.10	0.23	2.31	2.33	5.3
	(ii) From Continuing Operations after net					
	movement in regulatory deferral balances	1.38	0.38	2.70	3.32	4.6
	(iii) From Discontinued Operations	(0.28)	0.27	(1.38)	(0.15)	(1.52
	(I.A. Tatal Consenses and an anti-			,	,	, ,

Total ...

Profit (Loss) befor,
Profit (Loss) befor,
Profit (Loss) for the penuTotal Comprehensive Income
(Face Value TI- per share)

Total Reserves

Total 319.56

For and on behalf of the Board of THE TATA POWER COMPANY LIMITED

#### ાલાવલ હાલ્યટલમાં આક્સકળમાં તીવ્ર અછત ઉભી થતા રાજકોટ સહિતના શહેરોમાંથી સતત ગાડીઓ મારફતે ઓક્સિજનના સિલિન્ડર અને ૨૪ કલાક દરમિયાન અંદાજે ૧,૪૪,૦૦૦ લીટર એટલે કે ૨૦ મોટી બોટલ ભરી શકાય તેવી પત્નીના આઘાતમાં ૧૦૩ હેરફેર કરવામાં આવતા હતા અને થમતા છે. વર્ષના પતિનું પણ અવસાન મહાનગર સેવા સદન, જૂનાગઢ वीहर वर्षम शाम

જાહેર નિવીદા નં.3/૨૦૨૧-૨૨



.વ.જા.નં.૮૭ તા.૧૦/૦૫/૨૧ કમિક્તરશ્રી, જુનાગઢ મહાનગર સેવાસદન, "સ્વામી વિવેકાનંદ ભવન

ilલવામાં આવશે. આ કામો અંગેની વિગતવાર ટેન્ડર નોટીસ કચેરીના નોટીસ બોર્ડ અને માહિતી

	Last Date - 10/06/2021			
કોરા ભાવ પત્રક ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ	તા.૧૦/૦૬/૨૦૨૧			
તથા સમય	૧૮-૦૦ કલાક સુધી			
ભરેલ ભાવ પત્રક ઓન લાઇન ભરવાની છેલ્લી તારીખ	તા.૧૦/૦૬/૨૦૨૧			
તથા સમય	૧૮-૦૦ કલાક સુધી			
દેન્ઠર ડોકયુમેન્ટ ૨જી. પોસ્ટથી સબમીટ કરવાની છેલ્લી	તા.૧૫/૦૬/૨૦૨૧			
તારીખ તથા સમય	૧૮-૦૦ કલાક સુધી			
ભરેલ ભાવ પત્રકો ઓન લાઇન ખોલવાની સંભવિત	41.15/05/2021			
તારીખ તથા સમય	12-00 sells			

માળિયા હાટીનાનો બનાવ

સમોવડી સાબિત થઈ હતી. (મહેશ કાનાબાર)

માળિયા હાટીના, તા.૧૨ : ાળિયા હાટીનામાં મોટા પુલ માર્ભિયા કાંટાનામાં માટા યુવ પાસે જસાપરા વિસ્તારમાં રહેતા કોળી સમાજના ૯૦ વર્ષના પાચીબેન ઘેલાભાઈ ઘરસંડાનું આજથી ૧૦ દિવસ પહેલા અવસાન થયું હતું ગઈ કાલે તેમની ક્રિયા હતી. મહેમાનો સગા વ્હાલાઓ કુટુંબીજનો બધાએ ક્રિયાની વિધિ પૂરી કરી હતી.

ાકપાના વાય પૂરા કરા હતી. સમાજના રિવાજ મુજબ ધાર્મિક પાઠની શરૂઆત કરવાની હતી પણ ત્યાં તો પાચીબેનના પતિ ઘેલાભાઈ રામભાઈ ઘરસંડા (ઉ વ ૧૦૩) એ પણ પત્નીના



માળિયા હાટીનાના નાથલિયા બ્રાહ્મણ એસ ટીના નિવૃત્ત કર્મચારી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અગ્રેસર મહિલા કાર્યકર ભાનુબેનના પતિ હર્ષદરાઈ અમૃતરાઈ મહેતા (ઉ.વ.૭૦)નું અવસાન થયું છે. હર્ષદભાઈને સંતાનમાં પુત્ર નથી. ઉર્વશી અને વેભવી આ બે પુત્રી છે ત્યારે આ બંને બહેને પોતાના પિતાની સ્મશાનયાત્રામાં જોડાઈને પિતાની અર્થીને કાંય આપી તમામ વિધિ આ બંને પુત્રીએ કરી પુત્ર

> આમ પત્નીના અવસાનનું દુ:ખ સહન નહિ કરી શકતા પતિનું પણ ક્રિયાના દિવસે મૃત્યુ થયું છે. આ બનાવથી અરેરાટી મચી ગઇ છે.

વડોદરા મહાનગરપાલિકા

ખખખ, પાતા દુષ્ટામાં કહેરાત <u>ઇ-ટેન્ટરી/માં જાહેરાત</u> વડીદર મહુનગરપાલિકામાં શોચ્ય લિભાગ તેમજ ચોચ્ચ શ્રેણીમાં નોંધાયેલ માન્ય ઇન્ડરદારી પાસેથી તથા સરકારીભ્યંસતકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇન્ડરદારો પાઓના તો% અન્યત્રે લાધા માટે પાસેએ છો લાદપાત્રી ઓગવામાં આવે છે.

ય.ને.	પી.આર.ઓ.નંબર	વિભાગનું નામ	કામનીસંખ્યા	ચંદાજીત રકમ
1	156/51-55	પાણી પુરવઠા પ્રોજેક્ટ	09	50,66,302
5	131/21-22	ઇલે.મિકે.સુવેજ	09	83,34,228
3	932/29-22	પાર્કસ એન્ડ ગાર્ડન	09	40,00,000
٧	134/21-22	ડ્રેનેજ.વ.ગ.પ્રોજેક્ટ	9.0	1,14,00,000
Ч	130/21-22	િલ્હીંગ પ્રોજેકટ	90	1,80,00,000
પરોક્ત	કામના ટેન્ડર ફોર્મ હ	તથા વિસ્તૃત માફિતી ૧	ે તે સંબંધિત	વિભાગમાંથી ઉપરો
ചിചെ റ	வயசை பசரி பளி	aga garin airan	<ul> <li>น่องระบบ่อ</li> </ul>	nue fames ex

સૂચત પંખેસાઇટ પરથા મળા રફશ : સત્તા મ્યુનિસિપલ કમિશનરશ્રીની રઠેશે. પી.આર.ઓ.નં.૧૪૧/૨૦૨૧-૨૨ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રકાશિત



## ORIENT ABRASIVES LIMITED

Regd. Office: GIDC Industrial Area, Porbandar - 360577 (Gujarat). Tel. No.: + 91-286-2221788 Fax: + 91-286-222719 Website: www.orientabrasives.com, Investors Relations E-mail ID: investor@oalmail.co.in CIN No - 1 24299G11971PI C093248

Extract of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2021

SR. NO.		Quarter Ended			Year Ended	
		March 31, 2021	December 31, 2020 Unaudited	March 31, 2020 Audited	March 31, 2021 Audited	March 31, 2020 Audited
		Audited				
1.	Total Income from Operations (Net)	8,546.48	8,913.72	9,072.70	30,414.52	34,784.84
2.	Net Profit for the period / year before tax & exceptional items	525.70	497.01	635.40	1,596.47	2,760.08
3.	Net Profit for the period / year before tax	525.70	497.01	495.67	1,596.47	2,620.35
4.	Net Profit / (Loss) from ordinary activities after tax	258.41	430.65	435.41	1,136.99	2,055.91
5.	Total Comprehensive Income / (Loss) after tax	285.65	424.80	363.18	1,146.68	1,991.99
6.	Equity Share Capital (face value Re. 1/- per share) (Including Shares Forfeited Rs. 0.13 Lacs)	1,196.52	1,196.52	1,196.52	1,196.52	1,196.52
7.	Reserves (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)	•	-		-	-
8.	Earnings / Loss Per Share (EPS) (of Rs. 1/- each not annualised) Basic	0.22	0.36	0.36	0.95	1.72
	Diluted	0.22	0.36	0.36	0.95	1.72

ES:

The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter / Year ended on March 31, 2021 filed with the Stock Exchanges under Regulations 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the Quarter / Year ended on March 31, 2021 is available on the Stock Exchange websites, www.bseindia.com, awn on Company's website at www.orientabrasives.com
The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Orient Abrasives intitled ("the Company") at their respective meetings held on 11" May, 2021, in accordance with the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, as amended. The Statutory Auditor have issued an unqualified Audit opinion on these results.

The Board of Directors has recommended a Dividend of Re. 0.15 per Equity Share of Re. 1/F- each (i.e. 15%) for the year ended March 31, 2021 subject to the approval of shareholders in ensuing Annual General Meeting.

Whole Time Director & CEO

(Din: 07618837)

Place : Porbandar Date : 11<sup>n</sup> May, 2021



